

# કિડની અને કિડની નિષ્ફળતા



## હિમોડાયાલિસિસ

આ પરિચય-પુસ્તિકા તમને વિગતવાર રીતે હિમોડાયાલિસિસ (Haemodialysis) ની પદ્ધતિની સમજ આપશે. હિમોડાયાલિસિસમાં વપરાતીવિવિધ વસ્તુઓનું જ્ઞાન, આપદ્ધતિના લાભ અને ગેરલાભનું પણ વર્ણન આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.

iRf

હિમોડાયાલિસિસની પદ્ધતિમાં એક મશીનની મદદથી શરીરનું લોહી બહાર કાઢી ‘ડાયાલાઇઝર’ અથવા ‘કૃત્રિમ કિડની’ (artificial kidney) ની મદદથી રક્તશુદ્ધિ કરવામાં આવે છે અને તેને ફરીથી શરીરમાં મોકલાય છે. આમ કરવાનું કારણ એ છે કે દર્દની કિડનીઓ (મૂત્રપિંડો) નિષ્ફળ થઈ છે અને તેમનું કાર્ય કરવા સમર્થ રહી નથી.


### ડાયાલિસિસના સિદ્ધાંતો

ડાયાલિસિસના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે છે.

૧. લોહીમાં રહેલો કચરો સાફ કરવો જેમાં યુરિયા અને કિએટીનાઈન મુખ્ય હોય છે.
૨. લોહીમાંથી વધારાનું પાણી કાઢવું.
૩. લોહીમાં વધી ગયેલા એસીડે ઠારવો.

આ ઉદ્દેશો પુરા કરવા માટે બે પ્રક્રિયાઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એ છે “ડિફ્યુઝન” અને “અલ્ટ્રાફિલ્ટેશન”.

ડિફ્યુઝનના કારણે યુરિયા અને કિએટીનાઈન લોહીમાંથી સાફ થાય છે. લોહી અને ડાયાલિસિસ દ્રાવકમાં ઘરૂતાના તફાવતના લીધે ડિફ્યુઝન



શક્ય બને છે. દા.ત. લોહીમાં યુરિયા, કિએટીનાઈન વગેરેની માત્રા ખૂબ વધારે હોય છે, જ્યારે ડાયાલિસિસ દ્રાવણમાં હોતી જ નથી. એટલે યુરિયા, કિએટીનાઈન વગેરે લોહીમાંથી ડાયાલિસિસ દ્રાવણમાં આવી જાય છે.

ડિફ્યુઝનના લીધે ડાયાલિસિસ દ્રાવણમાં રહેલા એસીટેટ/બાયકાર્બોનેટ લોહીમાં પ્રવેશે છે અને લોહીમાં રહેલા એસિડને ઠારે છે. અલ્ટ્રાફિલ્ટ્રેશનથી વધારાના પાણીનો નિકાલ થાય છે. લોહી ડાયાલાઈજરમાં ઊંચા દબાણથી પસાર થાય છે, જ્યારે ડાયાલિસિસ દ્રાવણ ખૂબ જ નીચા દબાણે. આના કારણે વધારાનું પાણી લોહીમાંથી ડાયાલિસિસ દ્રાવણમાં જતું રહેછે.

### ડાયાલિસિસની પ્રક્રિયા

સોય નસમાં નાખીને લોહીને બહાર ખેંચીને પ્લાસ્ટિકની નળી વડે તે લોહીને ડાયાલાઈજરમાંથી પસાર કરવામાં આવે છે. લોહી અને ડાયાલિસિસ દ્રાવણ ક્યારે પણ ભેગાં થતા નથી કારણ કે ડાયાલાઈજર અધ્યપારગમ્ય રેસાઓથી બનેલું હોય છે. લોહી ડાયાલાઈજરમાંથી શુદ્ધ થઈને શરીરમાં પાછું આપવામાં આવે છે. આ પ્રક્રિયા ૪ થી ૫ કલાકની હોય છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરાવવી પડેછે.

લોહી અને ડાયાલિસિસ દ્રાવણની ગતિ ડાયાલિસિસ મશીન દ્વારા નિયમિત કરવામાં આવે છે. આ મશીન બીજી ઘણી જાણકારી નિયમન કરે છે જેમ કે ડાયાલિસિસ દ્રાવણનું તાપમાન, એમાં પાણીની માત્રા, એન્ટીકોગ્યુલન્ટની માત્રા વગેરે.

### હિમોડાયાલીસીસના મુખ્ય ઘટકો નીચે પ્રમાણે છે

- (૧) હિમોડાયાલિસિસ મશીન
- (૨) AVF સોય
- (૩) બ્લડલાઈન
- (૪) ડાયાલાઈજર

(૫) હિમોડાયાલિસિસ દ્રાવણ

(૬) એન્ટીકોગ્યુલન્ટ ઈન્જેક્શન (જે લોહીને ગંઠાઈ જતું અટકાવે છે).

## હિમોડાયાલિસિસ મશીન

નીચેની બાબતોનું નિયંત્રણ આ મશીન કરે છે

### ૧. ડાયાલિસિસ દ્રાવણનું ભ્રમણ :

- વહેણનો દર
- તાપમાન
- સંવાહન ક્ષમતા
- અશુદ્ધતા

### ૨. રક્તનું ભ્રમણ

- વહેણનો દર
- નસમાં લોહીનું દબાણ
- ધમનીમાં લોહીનું દબાણ
- પાણીનો નિકાલ

આ જટિલ યંત્ર તો છે, છતાં ઈજનેરી અને ટેકનિકલ વિકાસને પરિણામે તે વાપરવામાં સરળ અને વપરાશકારને વધુ સહેલું બની ગયું છે.

## AVF સોય

આછે Arterio Venous Fistula Needle. હિમોડાયાલિસિસની દરેક પ્રક્રિયા વખતે બે સોય વપરાય છે. પહેલી સોય શરીરમાંથી લોહીને બહાર લાવે છે, અને બીજી તેને શરીરમાં દાખલ કરે છે.

આ AVF સોય જાડી હોય છે અને નિયમિત કરેલા સ્થાને શરીરમાં તેને નાખવાની હોય છે. મોટે ભાગે જે હાથનો દર્દી બહુ વપરાશ ન કરતો હોય તે હાથમાં “ફિસ્યુલા” બનાવવામાં આવે છે. આ “ફિસ્યુલા”નો અર્થ એવું સ્થાન જ્યાં નસ અને ધમની એક સાથે જોડેલા હોય છે. આ “ફિસ્યુલા” બનાવવા માટે નાનું સરખું ઓપરેશન કરવાનું હોય છે.

હિમોડાયાલિસિસ ચિકિત્સામાં “ફિસ્યુલા” ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિના આ ચિકિત્સા કરવી શક્ય નથી. ફિસ્યુલા ના હોય એવા દાદીઓને કેથેટર વાપરવા પડેછે.




**દલડલાઈન કે લોહીની નળીઓ**

### **દલડલાઈન કે લોહીની નળીઓ**

લોહીની નળીઓ AVFની સોયના છેડા સાથે જોડેલી હોય છે. તેના બે ભાગ હોય છે. શરીરનું અશુદ્ધ લોહી વહેનારી નળી AVFની સોયમાંથી લોહીને લોહીના પંપ અને ડાયલાઈઝર સુધી લઈ જાય છે. ડાયલાઈઝરમાંથી શરીરમાં શુદ્ધ લોહી નાખનાર નળી એ અન્ય વિભાગ છે.

આ નળીઓ (દલડલાઈન્સ) ખાસ પ્રકારના પ્લાસ્ટિકથી બનેલી હોય છે. તે ઘણી નરમ અને વાળી શકાય તેવી હોય છે.



## ડાયાલાઈઝર

### ડાયાલાઈઝર

ડાયાલાઈઝર અથવા કૃત્રિમ મૂત્રપિંડ એ હિમોડાયાલિસિસની પ્રક્રિયાનું હાર્દ છે. અર્ધ-પારગમ્ય પદાર્થના પડદાઓથી બનેલી અનેક રેસાઓથી આનું બંધારણ રચાયેલું હોય છે. અર્ધ-પારગમ્ય એટલે કે એવા પ્રકારનું આવરણ જેમાંના છિદ્રો “કેટલાક પસંદગીનાં જ તત્ત્વોને દાખલ થવા અથવા નીકળવા દે છે”. ડાયાલાઈઝરના આ રેસાઓમાં લોહી સતત વહે છે. જ્યારે તેની આસપાસ ડાયાલિસિસનું દ્રાવણ સતત ફરતું રહે છે. પાણી, યુરિયા, કિએટીનાઈન અને વિષાકત કણો દ્રાવણમાં આવી જાય છે, પણ રક્તકણોને પસાર થવા દેવાતાં નથી. વળી, દ્રાવણમાંથી એસીટેટ/બાયકાર્બોનેટ અને અન્ય આયોન્સ (Ions)લોહીમાં ઉમેરવામાં આવેછે. આમ, જ્યારે ડાયાલાઈઝરમાંથી લોહી બહાર બીજી નળીમાં આવેછે ત્યારે તે સાફ થઈ ગયું હોય છે.

ડાયાલાઈઝરમાં મૂકવાના જુદા જુદા પ્રકારના અર્ધ-પારગમ્ય ફાઈબર મળે છે અને દરેકના પોતપોતાના લાભ અને ગેરલાભ હોય છે. દર્દીની આવશ્યકતા મુજબ ડાયાલાઈઝરની સાઈઝ પસંદ કરવામાં આવે

છે. દા.ત. નાની વયના દર્દને નાની સાઈજવાળું ફાઈબરનું ડાયાલાઇઝર જરૂરી બને છે, વગેરે.

## હિમોડાયાલિસિસનું દ્રાવણ

આ દ્રાવણમાં પાણી, સોડિયમ એસીટેટ/બાયકાર્બોનેટ, કેલ્થિયમ કલોરાઇડ, મેનેશિમ કલોરાઇડ, સોડિયમ કલોરાઇડ અને અન્ય ક્ષારો તથા આયન્સ મિશ્રિત હોય છે. લોહીની ઈલેક્ટ્રોલાઇટ સંરચનાની સમાંતરે આ દ્રાવણની સંરચના કરવાની હોય છે. તેમાં કોઈ જ વિશાકત કણ હોતા નથી. આને પરિણામે હિમોડાયાલિસિસ દ્રાવણ અને લોહીની ઘણ્ઠતામાં તરફાવત ઊભો થાય છે. આથી લોહીની અશુદ્ધિઓ આ દ્રાવણમાં આવી જાય છે.

આ દ્રાવણ રો ૧૦ લિટરના કેરબામાં ઉપલબ્ધ હોય છે. લોહીમાંથી અશુદ્ધિઓ કાઢવાનું કાર્ય પુરું થાય પછી આ દ્રાવણનો પણ નિકાલ કરી દેવામાં આવે છે.

ડાયાલિસિસ માટે ખૂબ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આ પાણી જ પેશાન્ટમાં ચેપનું કારણ બની શકે છે. એટલા માટે સ્વચ્છ પાણી એ હિમોડાયાલિસિસ માટે જરૂરી છે. હિમોડાયાલિસિસ માટે લાગતું પાણી ઘણા બધા યંત્રોમાંથી પસાર થઈને શુદ્ધ થાય છે.

## એન્ટી-કોગ્યુલન્ટ

ડાયાલાઇઝરમાંથી લોહીની પસાર થવાની કિયા દરમ્યાન નળીમાં લોહી ગંઠાઈ ન જાય તે હેતુથી એન્ટીકોગ્યુલન્ટનું ઈન્જેક્શન આપવામાં આવે છે. સામાન્ય રીતે દુનિયાભરમાં “હિપેરિન” નામનું ઔષધ આ માટે લોહીમાં ઉમેરવામાં આવે છે. તમારી દર્દી તરીકેની સ્થિતિ ઉપર આ ઔષધની માત્રા ઠરાવવામાં આવે છે. જે દર્દને રક્તસ્ત્રાવની શક્યતા વધારે હોય તો તેના માટે ખાસ પ્રકારના હિપેરિન ઈન્જેક્શન વપરાય છે. કિડની-નિષ્ણળતાના દર્દીઓ હંમેશા અલ્ફરક્તા (Anemia) ના પણ

દર્દી હોય જ છે. “હિપેરિન”ને લીધે લોહી ગંઠાઈ જતું નથી અને એ રીતે દર્દાનું જરાક પણ લોહી નકામું જતું નથી અને લોહી બચવાથી તેને ખૂબ રાહત મળેછે.

### **હિમોડાયાલિસિસ (HD)નાં ભયસ્થાનો**

#### **(૧) હાયપોટેન્શન (બ્લડપ્રેશર ઘટી જવું)**

ઓછા સમયમાં અને મોટા પ્રમાણમાં શરીરમાંથી પાણી બહાર નીકળવાને પરિણામે લોહીનું દબાણ નીચું થઈ જાય છે. આને હાયપોટેન્શનની સ્થિતિ કહેવાયછે.

#### **(૨) સ્નાયુઝેંચ (muscle cramps)**

લોહીના નીચા દબાણને પરિણામે સ્નાયુઓમાં પણ તણાવ/ઝેંચ અનુભવાયછે.

#### **(૩) અસંતુલનની ભાવના**

આ લક્ષણ અને અન્ય બીજા પણ, વ્યવસ્થાતંત્રો અને સ્નાયુતંત્રોમાં પેદા થતાં લક્ષણો છે. ડાયાલિસિસની પ્રક્રિયા દરમ્યાન અથવા તુરંતબાદ દર્દી સંતુલન ખોવાશે તેવી બીક અને ભાવના અનુભવેછે.



**હિમોડાયાલિસિસના દર્દી**

જે સર્વાંથી ઉંયાંલિછે; અનિયમીત રીત લેણા હેચ અઃવં/અને કુપોંશનાં શિકુંર હેચ અઃવં/અને વૃદ્ધ હેચ મને અંવી ભંવનાં અંવવંની શક્ય વદૂરે છે.

### હિમોડાયાલિસિસની પ્રક્રિયાના લાભ

- (૧) વ્યવસાયી રીતે કેળવાયેલ ડૉક્ટરોના અને વક્તિઓના નિરિક્ષણ હેઠળ આ પ્રક્રિયા કરવામાં આવેછે.
- (૨) અઠવાડિયામાં ત્રણ વાર લેવાની હોયછે.
- (૩) ચેપ લાગવાનો ભય નહિવત્ત રહેછે.
- (૪) તુલનામાં ઓછા ખર્ચની પ્રક્રિયાછે.

### હિમોડાયાલિસિસની પ્રક્રિયાના ગેરલાભ

- (૧) હિમોડાયાલિસિસના કેન્દ્ર પર દર્દીએ જવું પડેછે.
- (૨) હિમોડાયાલિસિસ મશીન ઉપર પેશાન્ટ આધારીત રહેછે.
- (૩) મીહું ખાવામાં પરેજ રાખવી પડેછે.
- (૪) હિપેટાઈટિસના ચેપની સંભાવના રહેછે.

### યાદ રાખવા જેવી બાબતો

૧. બે હિમોડાયાલિસિસ વચ્ચે વજનના વધારાને કાબુમાં રાખવો.
૨. ડાયાલિસિસ લેવાની નિયમિતતા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
૩. ખોરાક અને પાણીની પરેજ પાળવાથી તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. આપેલ દવાઓનું નિયમિત સેવન પણ ખુબ જરૂરી છે.

એ યાદ રાખવું જોઈએ કે કિડનીની નિષ્ફળતાને કોઈ ચિકિત્સા સફળતામાં ફેરવી શકતી નથી. આનું કારણ એ છે કે કિડનીમાં થયેલ નુકશાનને ભરપાઈ કરવાનું, તેને પુનઃકાર્યરત કરવાનું કામ અસંભવ છે. આ કે અન્ય ચિકિત્સાઓ મુખ્યત્વે એક જ ધ્યેય રાખે છે કે કિડનીની અવેજમાં વિવિધ રીતે શરીરના નકામા અને ઝેરીલા પદાર્થોનો નિકાલ કરવો.

## ચાવીડપ શાબ્દો

ડાયાલિસિસ, ડિમોડાયાલિસિસ, ડાયાલાઈજર, એન્ટીકોગ્યુલન્ટ, હાઈપોટેન્શન, અસંતુલન ભાવના.

## ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત નીચેની પરિયય-પુસ્તિકાઓ પણ ફૂપ્યા વાંચી જશો :

૧. તમારી ચિકિત્સાની પસંદગી
૨. પેરીટોનિયલ ડાયાલિસિસ
૩. ટ્રાન્સપ્લાટેન્શન (પ્રત્યારોપણ)
૪. ડાયાબિટીસ અને કિડની નિષ્ફળતા
૫. કિડની નિષ્ફળતા અને એનેમિયા
૬. કિડનીમાં પથરી અને કિડની નિષ્ફળતા
૭. હાયપરટેન્શન અને કિડની નિષ્ફળતા

આ પુસ્તિકાનું મકાશન જે.ડી. પ્રિન્ટર્સ, અમદાવાદ અને ગાજીજર સ્કેના કલર મા. લિ. અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ છે.



## ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન

૬૦-૬૧, એ વીંગ, નોબલ્સ, નહેર બ્રીજ સામે, આશ્રમ રોડ, અમદાવાદ -૩૮૦ ૦૦૯. ઇન્ડિયા.

ફોન : +૯૧-૭૯-૬૪૮૪૨૫૧, ફેક્સ : +૯૧-૭૯-૬૪૮૭૦૪૨

Email: [iwf@indiarenalfoundation.org](mailto:iwf@indiarenalfoundation.org)  
visit us at: [www.indiarenalfoundation.org](http://www.indiarenalfoundation.org)